

આપ નિઃસંતાન દંપતિ છો? તો સંતાન પ્રાપ્તિ માટેની ચમત્કારિક ગુરુચાવી

- ઝૂં ઋષિ પ્રિતેશભાઈ

આજના આ યુગમાં પણ સંતાન ન હોવું એ પતિ-પત્ની બંને માટે પુષ્કળ તકલીફ અને પરેશાનીઓનું કારણ બને છે. બહારથી નહિ પરંતુ અંદરથી આજે પણ ભણેલો ગણેલો સમાજ એને અભિશાપ જ ગણે છે. આજના આધુનિક સમયમાં સંતાનનો જન્મ, સંતાનનું એજ્યુકેશન તેમજ સંતાનનો જન્મ કઈ હોસ્પિટલમાં કરાવવો, કઈ સ્કૂલમાં ભણાવવું આ બધા પ્રશ્નો એ માન અને પ્રતિષ્ઠાનાં કારણો આજનાં ભણેલા ગણેલા લોકોએ બનાવી દીધા છે. જે ડોક્ટરની ફાઇવ સ્ટાર હોસ્પિટલ તેમજ જે સ્કૂલમાં એડમિશન લાખો રૂપિયા ડોનેશન આપીને મળે એવા ડોક્ટરો અને એવી સ્કૂલો સારી એવી માનસિકતા ભણેલા ગણેલા લોકોએ બનાવી દીધી છે. સંતાન માટે આ લેખ છે માટે જે દંપતીને ઇશ્વરે સંતાનરૂપી અણમોલ આશીર્વાદ આપ્યા છે તેમને આ લેખથી હું કહેવા માગું છું કે તમારા સંતાનોને આ રેસમાં દોડવી એમની આવડત તમે વધારવાને બદલે ઘટાડો છો. માટે તમારા સંતાનને દેખાદેખીમાં પાડવાને બદલે કુદરતે એમને જન્મથી આપેલી અંદરની આવડત બહાર લાવવાનો પ્રયત્ન કરો. નિઃસંતાન સ્ત્રી માટે આજના મેડીકલ સાયન્સે ઘણી ક્રાંતિ કરી છે પરંતુ એ ક્રાંતિ ખર્ચાળ અને સંપૂર્ણપણે સફળ તો નથી જ. આવા ક્રાંતિકારી યુગમાં પણ નિઃસંતાન દંપતીઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નિઃસંતાન દંપતી પોતાના જીવનમાં ઇશ્વરનાં આશીર્વાદરૂપ બાળક એમના ખોળામાં જન્મ લે અને એમના ઘરમાં આનંદ અને કિલ્લોલ કરે એ અપેક્ષા સાથે જ અને ખાતરી સાથે આ સત્ય ઘટના લખી રહ્યો છું.

2010, ઓક્ટોબર મહિનામાં એક દંપતી મારી પાસે આવ્યા. પતિ શેરબજારનાં ધંધા સાથે સંકળાયેલો હતો અને પત્ની હાઉસવાઇઝ હતી. લગ્નનાં સાત વર્ષ પછી પણ એમને ત્યાં પારણું બંધાયું ન હતું. ઘણીબધી દવાઓ કરી જેમાં આજનાં આધુનિક મેડીકલનાં રીસર્ચની પદ્ધતિઓનો પણ ઉપયોગ કર્યો જે ખૂબ જ ખર્ચાળ હતી, છતાં પણ એમાં સફળતા મળી નહિ. પતિ-પત્ની બંને બીજાના સંતાનોને જોઈને આનંદ પામતા પણ દિલનાં એક ખૂણે દુઃખ રહેતું કે એમને કોઈ સંતાન નથી. સંતાન માટે પથ્થર એટલા દેવ એ કરી ચૂક્યા હતા. મારા એક ભક્તનાં કહેવાથી અને સમજાવવાથી એ મારી પાસે આવ્યા હતા. પતિએ કહ્યું કે ગુરુજી અમે છેલ્લા છ વર્ષમાં બધું જ કરી ચૂક્યા છે. પરંતુ પરિણામ સાવ શૂન્ય આવ્યું છે. અમે બંને ખૂબ જ હતાશ થઈ ગયા છીએ. આપને વિનંતી કરું છું કે આપ અમને કોઈ સચોટ રસ્તો હોય તો જ બતાવજો. આપની ઉપર અમારી આખરી આશ ટકી છે. આટલું કહેતા પતિ-પત્ની બંનેની આંખોમાં આંસુ આવી ગયા. પત્ની બોલી કે ખબર નહિ કે ગયા ભવમાં કેવું પાપ કર્યું હશે કે મારે આ દિવસો જોવાના આવ્યા છે. મારી આ વેદનામાં રાત-દિવસ મારા દુઃખમાં જ વ્યતિત થાય છે. હું ઇશ્વરને રોજ પ્રાર્થના કરું છું કે અમારા જીવનમાં કંઈક એવો ચમત્કાર કરીને તું અમને સંતાન આપ. પતિ-પત્નીની વાત સાંભળી પતિ-પત્નીનાં મુખમુદ્રા અને ઓરા ઉપરથી મેં એ બંને ગણવા માટે મંત્રસાગરમાંથી એક

મંત્રરૂપી મોતી આપ્યું. મેં એમને કહ્યું કે આ મંત્ર તમારે મહિનામાં પચ્ચીસ દિવસ તેમજ ઐંકાર ચાલીસા પતિ-પત્નીએ રોજ કરવાના છે. આ મંત્ર અને ઐંકાર ચાલીસા કોઇપણ સમયે થઇ શકે. છઠ્ઠા મહિને પતિ-પત્ની બંને મારી પાસે આવ્યા. પતિ-પત્ની મને પગે પડીને કહ્યું કે આપે આપેલા આશીર્વાદરૂપી મંત્ર અને ઐંકાર ચાલીસાનાં માધ્યમથી મારી ધર્મપત્ની ગર્ભવતી બની છે. ડોક્ટરે ત્રણ મહિના આરામ કરવાનું કહ્યું છે. મારી પત્ની ગર્ભવતી થઇ એ દિવસ અમારા માટે સોનેરી સવાર લઇને આવ્યો છે. આપના આશીર્વાદ સદાય અમારા ઉપર રાખજો.

આ વાત સંપૂર્ણ સત્ય ઘટના છે. આ મંત્ર અને ઐંકાર ચાલીસા કરવાથી દુનિયાનાં કોઇપણ નિઃસંતાન દંપતીને અચૂક સંતાન પ્રાપ્તિ થશે.

મંત્ર: || ઐં સંતતિ ત્રુવા ત્રુવા કુડવ્ય કુડવ્ય નમઃ ||

આ મંત્ર પતિ-પત્નીએ જોડે બેસીને ગમે તે સમયે 71 વખત ગણવો અને જોડે ઐંકાર ચાલીસા ગણવા. મંત્ર અને ઐંકાર ચાલીસા ગણતી વખતે તાંબાનાં લોટામાં એક ગ્લાસ જેટલું પાણી લેવું. મંત્રથી અભિમંત્રિત થયેલું જળ પતિ-પત્નીએ અડધું અડધું પી જવું.

|| ઐં નમઃ ||